



JBB-16080002030505 Seat No. _____

M. Com. (Sem. III) (CBCS) (W.E.F. 2016) Examination

December - 2019

Advanced Business Statistics - III

(Statistical Inference)

(New Course) (Group-Sta.)

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : **70**

- સૂચના :** (1) બધા જ પ્રશ્નો ફરજિયાત છે.
 (2) જમણી બાજુએ ગુણ દર્શાવેલ છે.
 (3) અંકડાશસ્ત્રીય કોષ્ટક વિનંતીથી આપવામાં આવશે.

- 1 (અ) સમજાવો :** **15**
 (1) બિંદુ આગણન અને અંતરાલ આગણન.
 (2) પ્રમાણિત દોષ અને તેના ઉપયોગો
 (3) સારા આગણકના ગુણધર્મો.
 (બ) 60 કદના નિર્દર્શના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 145 અને 5
 40 હોય તો સમાચિના સાચા મધ્યકની 95% અને 99% વિશ્વસનીય સીમાઓ
 શોધો.

અથવા

- 1 (અ) આગણન ભાટેની મહત્તમ વિસંભાવનાની રીત સમજાવો અને મહત્તમ વિસંભાવના આગણકના ગુણધર્મો જણાવો.** **10**
(બ) સાબિત કરો કે નિર્દર્શ મધ્યક (\bar{x}) એ સમાચિ મધ્યક (μ) નો અનભિનત અને સંગત આગણક છે. **10**

- 2 (અ) T વિતરણના ગુણધર્મો અને ઉપયોગો જણાવો.** **10**
(બ) બે પ્રમાણ્ય સમાચિમાંથી લીધેલા નિર્દર્શો નીચે પ્રમાણો છે. સમાચિના વિચરણો સમાન છે. તે પરીક્લિનાનું પરીક્ષણ કરો. **10**

નિર્દર્શ - 1 9 11 13 11 15 9 12 4

નિર્દર્શ - 2 10 12 10 14 9 8 10

અથવા

- 2 (અ) બે ગુણધર્મોની સ્વતંત્રતાનું પરીક્ષણ સમજાવો. 10
 (બ) નીચેની માહિતી માટે પોયસન વિતરણનું અન્વાયોજન કરો અને તેની પોગ્યતાનું પરીક્ષણ કરો :

$x:$	0	1	2	3	4
$f:$	63	28	6	2	1

- 3 (અ) ગુરુનિર્દર્શ અને લઘુનિર્દર્શ પરીક્ષણો વચ્ચેનો તફાવત સમજાવો. 7
 (બ) F પરીક્ષણ સમજાવો. 8

અથવા

- 3 (અ) બે વિશાળ સમાચિમાં અનુક્રમે 25% અને 20% લોકો ભૂરી આંખોવાળા હતા. 1,000 અને 800 પરિમાણવાળા બે નિર્દર્શો અનુક્રમે બે સમાચિમાંથી લેતા આ તફાવત છૂપો રહેશે ?
 (બ) નીચેની માહિતી પરથી મધ્યકો વચ્ચે કોઈ તફાવત નથી એ પરિકલ્પનાનું 5% સાર્થકતાની કક્ષાએ પરીક્ષણ કરો :

નિર્દર્શ - 1 15 18 17 12 16

નિર્દર્શ - 2 18 21 19 22 13 27

- 4 (અ) પ્રાચલીય અને અપ્રાચલીય પરીક્ષણો વચ્ચેનો તફાવત સમજાવો. 7
 (બ) વિલકોક્ષન ચિહ્નન કમાંક પરીક્ષણ સમજાવો. 8

અથવા

- 4 નીચેની માહિતી 3 જૂથના વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર ગજા જુદી જુદી પદ્ધતિથી શિખ્યાના અંતે 100 ગુણમાંથી મેળવેલા ગુણ અંગેની છે :

$\mu_A:$ 75 78 74 80 85 64

$\mu_B:$ 77 79 55 67 81 62 86

$\mu_C:$ 88 60 72 73 83

ત્રણેય પદ્ધતિઓ સરખી અસરકારક છે. તે નિરાકરણીય પરિકલ્પનાનું પરીક્ષણ H-પરીક્ષણ દ્વારા 5% સાર્થકતાની કક્ષાએ કરો.

ENGLISH VERSION

Instructions : (1) All questions are compulsory.
(2) Marks are indicate on right side.
(3) Statistical tables will be provided on request.

- 1** (a) Explain : **15**
(1) Point estimation and interval estimation.
(2) Standard error and its uses.
(3) Properties of good estimator.
(b) A sample of 60 size has mean 145 and standard deviation 40. Find the 95% and 99% confidence limits of true population mean. **5**

OR

- 1** (a) Explain the maximum likelihood method of estimation and state the properties of maximum likelihood estimator. **10**
(b) Prove that sample mean (\bar{x}) is an unbiased and consistent estimator of population mean (μ). **10**

- 2** (a) State the properties and uses of t - distribution. **10**
(b) The following samples are drawn from two normal populations. Test the hypothesis that the population variances are equal : **10**

Sample-1 9 11 13 11 15 9 12 4

Sample-2 10 12 10 14 9 8 10

OR

- 2** (a) Explain independence of attributes test. **10**
(b) Fit the Poisson distribution to the following data and test the goodness of fit : **10**

$x:$	0	1	2	3	4
$f:$	63	28	6	2	1

- 3** (a) Explain the difference between small and large sample tests. **7**
 (b) Explain F test. **8**

OR

- 3** (a) In two large populations there are 25% and 20% blue eyed people resp. Is this difference likely to be hidden in samples of 1000 and 800 resp. from two populations ? **7**
 (b) From the following data test the hypothesis that there is no significance difference between two samples means at 5% level of significance : **8**

Sample-1 15 18 17 12 16

Sample-2 18 21 19 22 13 27

- 4** (a) Explain the difference between parametric and non-parametric test. **7**
 (b) Explain Wilcoxon signed rank test. **8**

OR

- 4** The following are the final examination marks out of 100 marks of 3 groups of students who were taught statistics by 3 different methods .: **15**

μ_A : 75 78 74 80 85 64

μ_B : 77 79 55 67 81 62 86

μ_C : 88 60 72 73 83

Use the H-test at the 5% level of significance to test the null hypothesis that the three methods are equally effective.
